



Industrial Training Institute

Directorate of Employment and Training
Government of Gujarat



सत्यमेव जयते
Government of Gujarat



Skill India
कौशल भारत - कुशल भारत

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના

પ્રવેશ માટેની લાયકાત :-

વયમર્યાદા

- સ્ત્રી કે પુરુષ
- ૧૪ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા ઉમેદવારો એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનામાં જોડાઈ શકે છે.
- જોખમી પ્રકારના ઉદ્યોગોમાં ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષની રહેશે

શૈક્ષણિક લાયકાત

- લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જુદા જુદા વ્યવસાયો (ટ્રેડ) માટે જુદી જુદી હોય છે.
- ધોરણ - ૮ પાસથી સ્નાતક પાસ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર આ યોજના હેઠળ નિયત વ્યવસાયોમાં (ટ્રેડ) માં તાલીમ મેળવી શકે છે.
- ઔદ્યોગિક /સેવાકીય એકમોમાં પોતાના એકમ ખાતે એપ્રેન્ટીસની ભરતી માટે નીચે મુજબના ઉમેદવારોની પસંદગી કરી શકે છે.
- (અ) આઈ.ટી.આઈ. / ડીપ્લોમા/ ડીગ્રી પાસ થયેલ ઉમેદવાર.
- (બ) ઉપરોક્ત (અ) મુજબની લાયકાત ન ધરાવતા પરંતુ ટ્રેડ માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર (ફેશર ઉમેદવાર)

એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના મુખ્યત્વે નીચે મુજબના ઉદ્દેશ અને હેતુ:

- શાળા છોડી ગયેલા ઉમેદવારો/ આઈ.ટી.આઈ./ડીપ્લોમા/ ડીગ્રી પાસ ઉમેદવારોને ખાનગી કે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક/ સેવાકીય એકમો ખાતેની On Job Training સુવિધાનો મહત્તમ લાભ આપી તેમને કૌશલ્ય કુશળ બનાવવા.
- જુદા જુદા વ્યવસાયોમાં ઔદ્યોગિક/ સેવાકીય એકમોના સહકારથી સૈધ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગ/ સેવાકીય એકમો માટેનું કુશળ માનવબળ ઉભું કરવું

તાલીમનું માળખું:-

એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અંતર્ગત એપ્રેન્ટીસોને: -

(૧) બેઝિક તાલીમ અને (૨) ઓન જોબ તાલીમ લેવાની રહે છે.

બેઝિક તાલીમ	
તાલીમ	બેઝિક તાલીમની જરૂરિયાત અને સમયગાળો
આઈ.ટી.આઈ./એન્જીનિયરીંગ કે ટેકનોલોજીમાં ડીપ્લોમા/ ડીગ્રી ધરાવનારને	મુક્તિ છે
Pradhan Mantri Kaushalya Vikas Yojana (PMKVY)/Modular Employability Scheme (MES) પાસથયેલ ઉમેદવારો	ને તેઓના સંલગ્ન ટ્રેડમાં બેઝિક તાલીમ લેવાની આવશ્યકતા રહેતી નથી
અન્ય ઉમેદવારો માટે સમયગાળાના:	
1. ૦૧ વર્ષના તાલીમી	1. ૦૩ મહિના
2. ૦૨ વર્ષના તાલીમી	2. ૦૬ મહિનાનો
જે તે વ્યવસાયની બેઝિક તાલીમ દરમિયાન જરૂરી સાધન સામગ્રી/હાથ ઓજારો તેમજ મશીનરીના ઉપયોગને લગતી પાયાની તાલીમ આપવામાં આવે છે. સેવાકીય ટ્રેડ માટે જે તે ટ્રેડનું પ્રારંભિક જ્ઞાન આપવામાં આવે છે.	
ઓન જોબ (શોપ ફ્લોર) તાલીમ	
બેઝિક તાલીમ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટીસોએ જે તે એકમ ખાતે શોપ ફ્લોર એટલે કે પ્રેક્ટીકલ તાલીમ મેળવવાની રહે છે.	

Earn while you learn | No Tuition fees | Career & Education Progression | Fast Track to Secured Career Path |

Wide Ranges of Sectors

પ્રવેશ સત્ર (ભરતીસત્ર અને સમયગાળો):-

- એકમ ખાતે એપ્રેન્ટીસની ભરતી - સમગ્ર વર્ષ દરમ્યાન થાય છે
- સમયગાળો - ૦૬ માસથી ૦૨ વર્ષ સુધીનો ટ્રેડ મુજબ અલગ અલગ હોય છે

ભરતીમાં અનામત

- ભારત સરકારે ગુજરાત રાજ્ય માટે અનુ. જાતિ માટે ૭ ટકા, અનુ. જન જાતિ માટે ૧૪ ટકા અને અન્ય પછાત વર્ગ માટે ૨૭ ટકા નું પ્રમાણ નક્કી કરેલું છે.

પ્રવેશ પ્રક્રિયા:-

- એપ્રેન્ટીસશીપ તાલીમમાં જોડાવવા માટે પોર્ટલ www.apprenticeship.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. જે માટે E-mail એકાઉન્ટ જરૂરી છે.
- આઇ.ટી.આઇ. ખાતે ઓફ-લાઇન રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ

એપ્રેન્ટીસને મળવા પાત્ર વૃત્તિકા (સ્ટાઇપેન્ડ):-

- એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી.
- તાલીમની સાથો સાથ એપ્રેન્ટીસો ને એકમ ધ્વારા હાલના પ્રવર્તમાન નિયમો મુજબ નીચે મુજબની લઘુત્તમ વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) તરીકે આપવામાં આવે છે. અર્ધ કુશળ કારીગરોને આપવામાં આવતા લઘુત્તમ વેતન દરના:- પ્રથમ વર્ષ - ૭૦ ટકા; બીજુ વર્ષ - ૮૦ ટકા અને તૃતીય વર્ષ - ૯૦ ટકા
- આમ છતાં એકમ સ્વેચ્છાએ ઉપરોક્ત રકમ કરતા પણ વધુ રકમની વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપી શકે છે.

પરિક્ષા પ્રમાણપત્ર :-

- તાલીમનો નિયત સમય પૂર્ણ થયા બાદ વ્યવસાયીક ધંધાની તાલીમ માટેની રાષ્ટ્રીય કાઉન્સિલ તરફથી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓક્ટોબર અંતિત અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજાવામાં આવે છે.
- સફળ થયેલા એપ્રેન્ટીસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર ભારત સરકારના સાહસો જેવા કે રેલ્વે, ઓ.એન.જી.સી.વિગેરેમાં કાયમી સેવા માટે પણ માન્ય છે.

એપ્રેન્ટીસ ભરતી મેળા	આવશ્યક દસ્તાવેજો
<ul style="list-style-type: none">• રાજ્યની તમામ આઇ.ટી.આઇ. ખાતે તા. ૧ લી એપ્રિલ ૨૦૧૮ થી તા. ૧૫ મી એપ્રિલ ૨૦૧૮ સુધી સવારે ૯ કલાક થી સાંજે ૫ કલાક સુધી ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબના દસ્તાવેજોની અસલ તેમજ ૧ સેટમાં ઝેરોક્ષ નકલ સાથે રૂબરૂ આવવું.	<ul style="list-style-type: none">• શૈક્ષણિક લાયકાતના પ્રમાણ પત્રોની નકલ• શાળા છોડ્યાના પ્રમાણ પત્રની નકલ• આધાર કાર્ડની નકલ• પાસપોર્ટ સાઇઝ નો ફોટો
નોંધ:-૧૮ વર્ષથી નીચેના ઉમેદવારોએ પોતાના વાલીને સાથે લાવવા	

:: સંપર્ક ::

- કોઇપણ ઉમેદવારો કે જેઓ એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા હોય, તેઓએ નજીકની આઇ.ટી.આઇ. / જીલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
- વધારે માહિતી માટે સંપર્ક કરો :- કોલ સેન્ટરનો નંબર ૧૮૦૦-૨૫૮-૫૫૮૮
- તેમજ વેબ સાઇટ – 1. www.employment.gujarat.gov.in | 2. www.apprenticeship.gov.in